

AH-110

April-2022

M.Com., Sem.-IV

508-EA/EB/EC/ED : Taxation-II

(Corporate Tax Planning and Goods and Service Tax)

(New)

Time : 2 Hours]

[Max. Marks : 50

- સૂચનાઓ : (1) વિભાગ-Iના બધા પ્રશ્નોના સરખા ગુણ છે.
(2) વિભાગ-Iમાં કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપો.
(3) વિભાગ-IIમાં પ્રશ્ન-5 ફરજિયાત છે.

વિભાગ-I

કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપો :

- (A) કંપનીના કર આયોજનને અસર કરતાં પરિબળો સમજાવો. 10
(B) કંપનીનો રહેઠાણનો દરજ્જો સમજાવો. 10
- (A) વસ્તુઓ અને સેવા કર (GST)ના કાયદા હેઠળ “ધંધો” અને “વસ્તુ” સમજાવો. 10
(B) વસ્તુ અને સેવા કરના કાયદાની વિશેષતાઓ સમજાવો. 10
- (A) ટૂંકનોંધ લાખો : વસ્તુઓ અને સેવા કર કાઉન્સિલ (પરિષદ) (GST Council) 10
(B) વસ્તુ અને સેવા કર હેઠળ વિવિધ કરમુક્તિઓની ચર્ચા કરો. 10
- (A) વસ્તુ અને સેવા કરના કાયદા હેઠળ “પૂર્તિસ્થળ” અને “પૂર્તિસમય” સમજાવો. 10
(B) ટૂંકનોંધ લાખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) 10

વિભાગ-II

- ચોગ્ય વિકલ્પ પસંદ કરો : (કોઈપણ પાંચ) 10
(1) વસ્તુ અને સેવા કર એ _____ છે.
(A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ
(2) _____ એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે.
(A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની
(C) ગૌણ કંપની (D) લિમિટેડ કંપની

- (3) મૂડી માળખાની રચનામાં નાણાકીય લીવરેજનો ઉપયોગ કંપની માટે કરની જવાબદારીના સંદર્ભમાં શયદાકારક બને છે, જ્યારે _____
- (A) રોકાણ પર વળતરનો દર, ઉછીના લીધેલ મૂડી પર વ્યાજના દર કરતાં વધારે હોય ત્યારે
 (B) રોકાણ પર વળતરનો દર, ઉછીની લીધેલ મૂડી પર વ્યાજના દર કરતાં ઓછો હોય ત્યારે
 (C) રોકાણ પર વળતરનો દર, ઉછીની લીધેલ મૂડી પર વ્યાજના દર જેટલો હોય ત્યારે
 (D) આમાંથી કોઈ નહીં
- (4) ધંધાનું _____ સ્વરૂપ એ કંપની સ્વરૂપ છે.
- (A) સહકારી મંડળી (B) ભાગીદારી પેઢી
 (C) હિન્દુ અવિભક્ત કુટુંબ (D) આમાંથી કોઈ નહીં
- (5) અંતરરાજ્ય (બે રાજ્યો વચ્ચે) વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ માટે _____ વસૂલ કરવામાં આવે છે.
- (A) સંકલિત વસ્તુઓ અને સેવાઓ વેરો (IGST)
 (B) કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ વેરો (CGST)
 (C) રાજ્ય વસ્તુઓ અને સેવાઓ વેરો (SGST)
 (D) આ બધા જ
- (6) ભારતમાં વસ્તુઓ અને સેવાઓ પરના વેરાની શરૂઆત _____ વર્ષમાં કરવામાં આવી.
- (A) 2017 (B) 2016 (C) 2018 (D) 2019
- (7) વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પરનો વેરો “વસ્તુ અને સેવા વેરો” એ _____ આધારિત છે.
- (A) ગંતવ્ય સ્થાન (Destination) (B) વિકાસ (Development)
 (C) ઉત્પાદન (Production) (D) ઉપભોગ (Consumption)
- (8) વસ્તુઓ અને સેવા વેરા (GST) ના કારણે _____ વેરાઓ રદ કરવામાં આવ્યા.
- (A) સેવા કરો (B) આવકવેરો
 (C) કંપની પરનો વેરો (D) આ બધા જ
- (9) વસ્તુ અને સેવા વેરાની કરપાત્રતા _____ ને આધારે નક્કી કરવામાં આવે છે.
- (A) વસ્તુ અને સેવાની પૂર્તિનું સ્થળ (B) વસ્તુ અને સેવાની પૂર્તિનો સમય
 (C) વસ્તુ અને સેવાનું મૂલ્ય (D) આ બધા જ
- (10) વસ્તુ અને સેવા વેરાના દરો _____ દ્વારા નક્કી કરવામાં આવે છે.
- (A) ભારતના નાણાપ્રધાન (B) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
 (C) ભારતના વડાપ્રધાન (D) જી.એસ.ટી. કાઉન્સિલ (પરિષદ)
- (11) _____ પર વસ્તુ અને સેવા વેરો (GST) લાગુ પડતો નથી.
- (A) તમાકુ (B) સોનું (C) બેન્ક ચાર્જીસ (D) પેટ્રોલ
- (12) વસ્તુ અને સેવા વેરાનો આખરી બોજ _____ પર પડે છે.
- (A) ઉત્પાદક (B) છુટક વેપારી (C) સરકાર (D) આખરી ઉપભોક્તા

AH-110

April-2022

M.Com., Sem.-IV

508-EA/EB/EC/ED : Taxation-II

(Corporate Tax Planning and Goods and Service Tax)

(New)

Time : 2 Hours]

[Max. Marks : 50

- Instructions :** (1) All questions in **Section-I** carry equal marks.
(2) Attempt any **two** questions in **Section – I**.
(3) Question No. **5** in **Section – II** is compulsory.

SECTION – I

Attempt any **two** questions :

1. (A) Explain factors affecting Tax Planning of a Company. **10**
(B) Explain Residential status of a Company. **10**
2. (A) Explain “Business” and “Goods” under GST Act. **10**
(B) Explain salient features of GST Act. **10**
3. (A) Write a short note on : GST Council. **10**
(B) Discuss various exemptions from GST. **10**
4. (A) Explain, “Place of Supply” and “Time of Supply” under GST Act. **10**
(B) Write a short note on : Input Tax Credit. **10**

SECTION – II

5. Select correct alternative. (Attempt any **five**) **10**
 - (1) GST is _____
 - (A) Indirect tax
 - (B) Direct tax
 - (C) Cess
 - (D) All of these
 - (2) A company in which that other company has a significant influence, but which is not a subsidiary company of the company having such influence and includes a joint venture company is _____.
 - (A) Associate Company
 - (B) Holding Company
 - (C) Subsidiary Company
 - (D) Limited Company

- (3) Use of financial leverage in formation of Capital Structure is beneficial in Corporate Tax liability, when _____
- (A) Rate of Return on Investment is higher than rate of interest on borrowings.
(B) Rate of Return on Investment is less than rate of interest on borrowings.
(C) Rate of Return on Investment is equal to the rate of interest on borrowings.
(D) None of these
- (4) _____ form of business is corporate form of business.
- (A) Co-operative Society (B) Partnership firm
(C) HUF (D) None of these
- (5) For Inter-State Supply of Goods and Services _____ is levied.
- (A) IGST (B) CGST
(C) SGST (D) All of these
- (6) GST was introduced in India in the year _____.
- (A) 2017 (B) 2016
(C) 2018 (D) 2019
- (7) GST on supply of Goods and Services is based on _____
- (A) Destination (B) Development
(C) Production (D) Consumption
- (8) Which of the following tax was abolished due to GST ?
- (A) Service Tax (B) Income Tax
(C) Corporate Tax (D) All of these
- (9) Taxability of GST is decided on the basis of _____
- (A) Place of supply of Goods and Services
(B) Time of supply of Goods and Services
(C) Value of supply of Goods and Services
(D) All of these
- (10) Rates of GST are decided by _____.
- (A) Finance Minister of India (B) RBI
(C) Prime Minister of India (D) GST Council
- (11) GST is not applicable on _____
- (A) Tobacco (B) Gold
(C) Bank Charges (D) Petrol
- (12) The ultimate burden of GST is on _____
- (A) Manufacturer (B) Retailer
(C) Government (D) End Consumer
-